



ભારતીય ઈતિહાસની ધરોહર સમાન અભિલેખવિદ્યાનો વિકાસ : એક પરિચય

પ્રા. રાજેશકુમાર જી. ચૌધરી

આસીસ્ટન્ટ પ્રોફેસર,

કલેજ ઓફ એજ્યુકેશન, દરામલી

૧. અભિલેખ કોને કહેવાય ?

માટી, પથ્થર, ધાતુ, લાકું વગેરે પદાર્થો ઉપર કોતરેલું લખાણ તે ‘અભિલેખ’ અથવા કોતરલેખ કહેવામાં આવે છે. એના લખાણને ઉકેલી ઈતિહાસ આલેખવા માટે માહિતી તારવવાની પ્રક્રિયાને અભિલેખવિદ્યા કહેવાય છે. ભારતમાં મૃત્યુના, ખડક, પથ્થર, ઈટ, શાંખ, હાથીદાંત, ધાતુ, લાકું, સંતસ, પ્રતિમાની પીઠિકા (બેસણી), તકતી વગેરે પદાર્થો ઉપર લખાણ કોતરેલાં જોવા મળે છે. ઘડીવાર સિક્કાઓ કે મુદ્રાઓ ઉપર ઉપસાવેલાં લખાણ કે ગુફાની લીટો ઉપર ચિત્રિત દ્વસ્તાવેજોને પણ અભિલેખ કે કોતરલેખ કહેવામાં આવે છે. ફારસી, અરબી લિપિના લેખોમાં ખાસ કરીને ભારતીય મૂળાક્ષરો કોતરેલા નથી હોતા, પરંતુ પ્રત્યેક અક્ષરની આસપાસની જગ્યાને કોતરવામાં આવતાં કોરયા વિનાની જગ્યાને અક્ષરરૂપે ઊપસી આવતી. આ પ્રકારનાં લખાણોને પણ કોતરલેખ - અભિલેખ તરીકે ઓળખવામાં આવે છે.

૨. અભિલેખના પ્રકાર

ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ તેમ જ આલેખનમાં અભિલેખો એક શ્રેષ્ઠ સાધન ગણાયું છે. અભિલેખોના મુખ્ય ત્રણ પ્રકાર છે ૧. પથ્થરલેખ ૨. સિક્કાલેખ ૩. પત્રલેખ

અભિલેખોના પ્રકાર

પથ્થરલેખ	સિક્કાલેખ	પત્રલેખ
૧. શિલાલેખ	૧. સોનાના સિક્ક	૧. તાપત્રપત્ર
૨. સંતસલેખ	૨. ચાંદીના સિક્કા	૨. રંગત્રપત્ર
૩. પ્રતિમાલેખ	૩. તાંબાના સિક્કા	૩. તાડપત્ર
૪. સ્મારકલેખ	૪. સીસાના સિક્કા	૪. લૂર્જપત્ર
૫. મૃદ્દલાણ્યલેખ		૫. કાપડ ઉપરનું લખાણ

અભિલેખોના આ બધા નમુના પૂર્વ-પૂર્વકાળ અને ઉત્તર-પૂર્વકાળમાં વિશેષ પ્રાપ્ત થાય છે ; કેમ કે ત્યારે કાગળ અને મુદ્રણયંત્રનો પ્રવેશ થયો ન હતો. કાગળ ઉપર છાપવાનો પ્રક્રિયાનો પ્રારંભ થયો તે પણી લખાણ માટેનાં ઉપર્યુક્ત સાધનોનો પ્રચાર કમશા: ઓછો થતો ગયો. છતાંય આજેય એક યા બીજા પ્રસંગો નિભિતે આવા અભિલેખોનો ઉપયોગ ક્યારેક ક્યારેક જોવા મળે છે. અર્વાચીનકાળમાં ધાર્મિક ઈમારતો, ડેળવણીની સંસ્થાઓ, મકાનો, ગ્રંથાલયો, સાર્વજનિક કે સામાજિક કે સરકારી સંસ્થાની ઈમારતોની લીત ઉપર ક્યારેક ખાતમુહૂર્ત, તો ક્યારેક વાસ્તુમુહૂર્ત, તો ક્યારેક બંને વિધિને નિર્દ્દશાં લખાણો કોતરેલી તકતીઓ મૂકવામાં આવે છે. એમાં ક્યારેક દાતાનું નામ-નામો કોતરેલાં જોવા મળે છે, તો ક્યારેક ઉદ્ઘાટક કે સમારંભના પ્રમુખ વગેરેનો નામનિર્દ્શા હોય છે. સામાજિક કે રચનાત્મક કે શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓના રાજ્ય કે રાષ્ટ્ર તરફથી કે ક્યારેક આંતરરાષ્ટ્રીય સંસ્થા તરફથી થતા સાન્માનના પ્રસંગે પત્રલેખ આપવાનો રિવાજ જોવા મળે છે. વાસણો ઉપર આજેય નામ કોતરવામાં આવે છે.

૩. અભિલેખની લંબાઈ

અભિલેખોની લંબાઈ પણ બિના બિના જોવા મળે છે. ક્યારેક એકાદ શબ્દનો લેખ હોય છે, જેમાં વ્યકિતનું કે યાગ્રાણુંનું કે કઢ્યાનું નામ હોય છે. આનાથી થોડા લાંબા લેખોમાં ક્યારેક મૂર્તિ પ્રસ્થાપન કે મૂર્તિ નિર્માણને લગતું લખાણ, તો ક્યારેક યુધ્ધમાં માર્યો ગયેલા

વીરપુરખની પ્રશસ્તિરૂપ લખાણ કે વિધવાનું આત્મસમર્પણ (સતી થયું) નિર્દ્દરશ્ટ લખાણ, તો વળી ક્યારેક દેવને લોગ ધરાવ્યાનો ઉલ્લેખ કરતું લખાણ વગેરેનો સમાવેશ થાય છે. મોટાભાગના લખાણો ગદ્યમાં હોય છે, તો ઘડીવાર પદ્યમય લખાણો ય પ્રાપ્ત થાય છે. જૂનાગઢના અશોક શૈલલેખવાળા ખડક ઉપરનો સ્કંદગુપ્તનો લેખ પદ્યમાં છે. શામળાજ નજીક દેવની મોરીના સ્તુપમાંથી પ્રાપ્ત દાબડાલેખ પણ પદ્યમાં છે. ઉદ્ઘેરનો રાજસમુક્તનો લેખ રાજપ્રશસ્તિ કાવ્ય તરીકે ઓળખાય છે. અપવાદરૂપે ક્યારેક નાટકની પદ્ધતિના અસિલેખ મળ્યા છે. અજમેરના લલિતવિગ્રહરાજનો લેખ આ પ્રકારનો છે.

૪. માનવસંદર્ભ અભિલેખોના પ્રકાર

પદ્ધતિના સંદર્ભમાં અભિલેખોના પ્રકારની વાત અગાઉ નોંધી છે. પણ માનવીના સંદર્ભમાં અભિલેખોના બે પ્રકારની વિગતો અહીં નોંધવી જરૂરી છે.

૪.૧ રાજાઓ કે રાજા વતી કોઈએ કોતરેલાં લખાણો

/ કોઈ વ્યક્તિ કે મંડળ વતી કોતરેલાં લખાણો

૧. ફરમાન (દા.ત.અશોકના શિલાલેખો)
૨. કાવ્ય કે પ્રશસ્તિરૂપે રાજાની સિદ્ધિને યાદ કરતા લેખો (રુક્માનો જૂનાગઢ શૈલલેખ અને સમુદ્રગુપ્તની અલાહાબાદની પ્રશસ્તિ)
૩. બાહ્યમણ કે ધાર્મિક સંસ્થા કે યોગ્ય વ્યક્તિ/અધિકારીને આપવામાં આવેલ દાન
૪. પરચૂરણ લેખો

આમાં, પ્રશસ્તિ પ્રકારના લેખો મોટેભાગે રાજ કવિઓએ કે શ્રેષ્ઠ કવિઓએ રચ્યા હોઈ તેમની ગુણવત્તા ઊંચી કોટીની હોય છે. દાત. સમુદ્રગુપ્તનો અલાહાબાદનો સંતંખલેખ (ઈ.સ.૩૬૦) કવિ હરિષેણનો છે. શાંતિવર્માનો તલગુંડનો લેખ (ઈ.સ.૪૬૦) કુઞ્જ નામના કવિનો છે. ઈ.સ. ૪૭૭નો મંદુસોરનો લેખ વત્સસૃષ્ટીનો છે. પુલકેશી રાજાનો ઐહોલનો લેખ (ઈ.સ.૫૨૪) રવિકીર્તિનો છે. નોંધપાત્ર હક્કિકત એ છે કે આમાંના ઘણા કવિઓની જાણકારી આ લેખોથી જ પ્રાપ્ત થઈ છે ; કેમ કે એમની અન્ય રચનાઓ નાફ પામી છે. પરંતુ સંતંખ કે તકતી કે તામ્રપત્ર ઉપર પ્રશસ્તિ કોતરવાની પદ્ધતિ મુસ્લિમ વિજેતાઓએ છોડી દીધી. માત્ર મરિજદો, મકબરા કે મહેલોના સંદર્ભમાં પથરલેખો કોતરવાનું ચાલુ રાયું. આથી મુસ્લિમ શાસન-અમલના ભારતમાંથી પ્રશસ્તિલેખો અને તામ્રપત્રલેખોની ઉપલબ્ધિનું પ્રમાણ ઘણું ઓછું રહેયું છે. એમના શાસન દરમિયાન કાગળનો વપરાશ શરૂ થયો. મુસ્લિમ શાસકોએ કાગળ ઉપર લખેલાં ઘણાં ફરમાન બહાર પાડ્યાં, તેથી શિલાલેખોની પ્રથા બંધ થવા લાગી. બ્રિટિશ અમલ દરમિયાન દસ્તાવેજો (સરકારી દૃક્તરે) નોંધવાની પ્રથાનો આરંભ થતાં તામ્રપત્રોની પદ્ધતિ બંધ થઈ. પરંતુ સિક્કાલેખોની પ્રથા ચાલુ રહી છે અને એમાં વૈવિધ્ય અને નવીનતાએ પ્રવેશ કર્યો છે.

૫. લિપિઓ અને તેનું વાંચન

આ બધા અભિલેખો તો જે તે સમયની પ્રચલિત લિપિમાં અને સર્વમાન્ય ભાષામાં કોતરાતા-લખાતા. ભાષાની જેમ સમયની સાથે લિપિમાં પણ ફેરફાર થતા રહ્યા. આરંભમાં ખરોઝી પછી બ્રાહ્મી લિપિ પૂર્વકાળમાં પ્રચલિત હતી. મુસ્લિમોના આગમન સાથે અરબી અને ફારસી લિપિ અને પછીથી ઉર્દુ લિપિ પ્રચારમાં આવી. આ સમય દરમિયાન બ્રાહ્મીમાંથી અવતરેલી પ્રાદેશિક લિપિઓ પણ રૂઢ થતી ગઈ, જે પછીના સમયમાં ઉત્તોતર વધારે વૈજ્ઞાનિક રીતે લખાતી ગઈ. બ્રિટિશકાલ દરમિયાન અને તે પૂર્વ પોર્ટુગીચ, ડચ, ફેન્ચ અને રોમીય લિપિઓ પ્રવર્તમાન હતી. ખાસ કરીને પૂર્વકાળમાં અભિલેખો શ્રેષ્ઠ માધ્યમ હોઈ એને કોતરનારાઓનો એક વર્ગ હતો. અનેક લોકો કોતરવાનું કામ કરતા હોઈ એક જ લિપિના અક્ષરોના મરોડમાં ઘણો તફાવત રહેતો. આથી આ લિપિ ઉકેલવાનું કામ અનિવાર્ય અને નિષ્ણાતની અપેક્ષાવાળું બન્યું. આમ પહેલાની લિપિઓના અભ્યાસની પ્રક્રિયા શરૂ થઈ, જેને પ્રાચિન-લિપિવિદ્યા કહેવાય છે. લિપિજ્ઞાન અને ભાષાની જાણકારી વિના અભિલેખો ઉકેલી કે વાંચી શકાય નહીં. લિપિ અને ભાષા જાણનાર લેખનો પાઠ તૈયાર કરે છે. આ પ્રક્રિયાને વાંચનક્ષય કહેવાય છે. લિપિ ઉકેલી જે પાઠ તૈયાર થાય છે તેનું અર્થધટન કરવામાં આવે છે. મૂળ લિપિના લેખને હાલની પ્રચલિત ભાષા લિપિમાં આપવાની પદ્ધતિને લિપ્યંતર કહેવાય છે.

૬. અભિલેખોમાંની સાધા

લખાય તે લિપિ અને બોલાય તે ભાષા તથા બંનેના સુમેળથી જે કૃતિ તૈયાર થાય તે સાહિત્ય. ભારતીય અભિલેખો જે તે પ્રદેશ કે રાજવંશના સમયમાં પ્રચલિત ભાષામાં લખાયા છે. આને રાજભાષા કે લોકભાષા કહી શકાય. ઐતિહાસિકકાલનાં આરંભિક લખાણોમાં સામાન્યત પ્રાકૃત ભાષા પ્રયોજયેલી. અશોક મૌર્યના મોટા ભાગના અભિલેખો આ ભાષામાં છે. ઉપરાંત શુંગ, સાતપાહન, ચેદી,

પદ્ધતિવ વગેરે વંશોના ઘણા લેખો પ્રાકૃતમાં છે તો કેટલાક પ્રાકૃત મિશ્રિત સંસ્કૃતમાં છે. ઈશુની પૂર્વની પહેલી સદીથી પ્રાકૃતના સ્થાને સંસ્કૃત ભાષાનો ઉપયોગ વધ્યો, ખાસ કરીને ઉત્તર ભારતમાં તો દક્ષિણમાં લગત્તગ ચોથી સદીથી એનો પ્રયોગ જણાય છે. દક્ષિણમાં કેટલાક અભિલેખો તમિજ (દ્વિંદિ) ભાષામાં કોતરાયેલા છે. તમિજ પછી કન્નડ (છઢી સદીથી), મલયાણમ (૧૫મીથી તમિજની જગ્યાએ), તુણ (૧૫ મી સદીથી) લિપિઓ વપરાવા લાગી. મુસ્લિમ શાસકોના અભિલોભોમાં અરબી-ફિરસી તો હિન્દુ શાસકોના સમયમાં સંસ્કૃત ભાષા વપરાતી હતી. ધીમે ધીમે સંસ્કૃત ભાષાનું સ્થાન પ્રાદેશિક ભાષાઓએ લીધું જેમાં મરાಠી ભાષાએ પ્રારંભ કર્યો. એનો જૂનામાં જૂનો નમૂનો ઈ.સ.૮૭૪નો ચૌલુક્ય રાજા સત્યાશ્રયના તામ્રપત્રનો છે. હિન્દી ભાષાનો ઉપયોગ ૧૧ મી સદીથી જોવા મળે છે, જવાલિયરના આસપાસના વિસ્તારમાં. ગુજરાતમાં સંસ્કૃતની અસરવાળા ગુજરાતી અભિલેખો ૧૪મી સદીથી પ્રાપ્ત થાય છે. અને ૧૫ મી સદીથી એકલી ગુજરાતીમાં.

૭. અભિલેખોમાં વર્ણિત વિષયવસ્તુ

પૂર્વકાલના શિલાલેખમાં રાજાના પરાક્રમોનું, સિદ્ધિઓનું કે વિજયોનું વર્ણન તથા પૈસાપાત્ર વ્યક્તિઓએ કરેલાં દાન કે પૂર્વકાર્યોનું પ્રસંશાયુક્ત વર્ણન જોવા મળે છે. આમાં ખાસ કરીને મંદિરનું બાંધકામ કે જીર્ણાધાર, તળાવ, કૂવા, વાવ વગેરે જળાશયોની રચનાની માહિતી વિશેષ જોવા મળે છે. તામ્રપત્રોમાં ભૂમિકાના વિગતો સાથે દાન આપનાર રાજા અને પૂર્વજોની માહિતી, ઉત્સવો, જાહેર તહેવાર વગેરેની હડીકતો હોય છે. મોટાભાગના અભિલેખોમાં સમયનો પણ નિર્દ્દશ હોય છે. આવા ઉલ્લેખ બે પ્રકારે જોવા મળે છે. ૧. રાજકાલનાં વર્ષો દા.ત. અશોક, શુંગ, સાતવાહનવંશના અભિલેખો ૨. સંખ્યા સંવતનાં વર્ષો. શક-પણ્ણલવ રાજાઓના લેખોમાં આની શરૂઆત જોવા મળે છે. ભારતનાં ઘણા સંવતો પૂર્વકાલમાં પ્રચલિત હતા જેમાંથી વિક્રમ અને શક સંવતો આજેય પ્રચારમાં છે. આ બે ઉપરથી પૂર્વકાલમાં કલચુરી-ચેટી, ગુપ્ત, વલભી, ગાંગેય, હર્ષ, સિંહ, યુદ્ધિષ્ઠિર, વીર નિર્વાણ વગેરે સંવતો જે તે રાજવંશો અને પ્રદેશો પૂરતાં પ્રચારમાં હતા. પછીના કાલમાં હિજરી સંવત (૧૫-૭-૬૨૨) થી શરૂ થયો. જે આજેય ભારતના મુસ્લિમાનો વાપરે છે. બ્રિટિશ અમલ દરમિયાન ભારતમાં ઈસ્લેમિક શરૂ થયો તે આજના ભારતમાં પણ વધારે લોકપ્રિય છે. વિક્રમ અને શક સંવત ખાસ કરીને બ્રાહ્મણો, જ્યોતિષો, ખગોળવિજ્ઞાનીઓ અને ધાર્મિકો વાપરે છે.

૮. અભિલેખોની કેટલીક મર્યાદાઓ

બધા ૪ કોતરલેખો ઐતિહાસિક દસ્તાવેજો છે તેમ કહી શકાય નહીં. જો કે એમાંના મોટાભાગના તો ઐતિહાસિક બનાવો કે વ્યક્તિઓની ચોકક્સ માહિતી આપે છે, પરંતુ એમાં પ્રસંશાનું તત્ત્વ, કાલયુદ્ધમતા અને રૂઢિગત તત્ત્વોનું ક્યારેક પ્રાબલ્ય વધી જતું એને પરિણામે ઈતિહાસને ગૌણ થતો જોઈ શકીએ છીએ. કોતરલેખમાં લેખકને જગ્યાની મોકળાશની પણ મુશ્કેલી અનુભવવી પડે છે. આથી ઘણીવાર અસંતોષકારક વર્ણન પ્રાપ્ત પડે છે. પૂર્વજોના નામોનો જરૂર ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ એમના વિશેની ઘણાણના જગ્યાવા મળતી નથી. સમકાળીન અથવા બે લિન્ન લેખકોની કે એક ૪ લેખકના બે લિન્ન લખાણોની લિપિકરણ પદ્ધતિમાં વ્યક્તિગત કક્ષા ભેદ આલેખનની બાબતમાં રહેવાનો.

વિવિધ અભિલેકોની ચિત્રાત્મક રજૂઆત



સંદર્ભસૂચિ

- ઓઝા, ગૌરીશંકર (૧૮૮૪). ભારતીય પ્રાચીન લિપિમાળા.
- ઉપાધ્યાય, વાસુદેવ (૧૮૬૧). પ્રાચીન ભારતીય અભિલેખોકા અધ્યયન. દિલ્હી.
- જમીનદાર, રસેશ (૧૮૮૮). ઈતિહાસ : સંક્લિના અને સંશોધન. અમદાવાદ.